

પ્લાન્ટ પ્રોટેક્શન એસોસીએશન ઓફ ગુજરાત અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પાક સંરક્ષણ
વિષય ઉપર વેબીનાર યોજાયો

આજની કોવીડ-૧૯ની મહામારીમાં ખેડૂત સભાઓનું આયોજન થઈ શકે તેમ ન હોઈ ખેડૂતોને તેમની ખેતીમાં પાક ઉત્પાદનના અવરોધક પરિબલો પૈકી રોગ જીવાત મુખ્ય છે. રોગ જીવાતથી પાકનું ઉત્પાદન ઘટે છે સાથે સાથે ગુણવત્તા પણ બગડે છે જેથી આર્થિક ખોટ જાય છે. તેથી ખેડૂતોને રોગ જીવાત - નિયંત્રણ અંગે ઘરે બેઠા માર્ગદર્શન મળી રહે તેમજ આ ૨૦૨૦નું વર્ષ આંતર રાષ્ટ્રીય પાક તંદુરસ્તી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે તે અનુસંધાને પ્લાન્ટ પ્રોટેક્શન એસોસીએશન ઓફ ગુજરાત અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૦-૦૮-૨૦૨૦ ના રોજ “ખરીફ પાકોમાં પાક સંરક્ષણના પ્રવર્તમાન પ્રશ્નો અને નિરાકરણ” વિષય ઉપર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. આ વેબીનારમાં કુલ ૧૧૫૦ વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવેલ.

આજના વેબીનારની શરૂઆતમાં પીપીએજીના ઝોનલ કો-ઓર્ડિનેટર ડૉ. આર.જી. પરમારે આ વેબીનારમાં જોડાયેલ સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું. ડૉ. જે. જી. પટેલ, પ્રમુખશ્રી દ્વારા પીપીએજી શું છે અને ખેડૂતો માટે શું શું કાર્ય કરે છે તે અંગેની રૂપરેખા આપી.

આજના વેબીનારમાં ઉદઘાટક અને અધ્યક્ષ તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ આર.વી વ્યાસ સાહેબે જણાવ્યું કે આ વેબીનારનું સમયોજિત આયોજન થયેલ છે. જેમાં રોગ જીવાત વ્યવસ્થાપન, નીંદણ નિયંત્રણ, પાક ઉપજમાં દવાઓના અવશેષો અને રણતીડના વ્યાખ્યાનો સમાવેશ કરી ખેડૂતોને આજની જરૂરિયાતોને ધ્યાને લઈ કરવામાં આવેલ છે તે ખુબ જ ઉપયોગી થશે. વધુમાં તેઓએ આજની નવી ટેકનોલોજી ડ્રોન પદ્ધતિથી પાક સંરક્ષણ ઉપર ખાસ ભાર મૂકી વૈજ્ઞાનિકોને આ બાબતે સરકારશ્રીની જરૂરી મંજૂરી મેળવી અને ખેડૂતો તેનો સરળતાથી ઉપયોગ કરી શકે તે અંગેની તાંત્રિકતા વિકસાવવા ઉપર ખાસ ભાર મુક્યો. જેથી ઉભા પાકોમાં અને ખાસ કરીને શેરડી જેવા પાકોમાં કે જ્યાં ઉભા પાકમાં વચ્ચે જઈ શકાતું નથી ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવાથી રોગ જીવાત અંગે અવલોકન લઈ સરળતાથી નિયંત્રણના પગલા લઈ શકે જેથી ખેડૂતોને ઓછા ખર્ચે સમયસર પગલાં લેવામાં સરળતા રહે.

વેબીનારમાં અતિથીવિશેષ તરીકે ઉપસ્થિત રહેલ ડૉ. આર. કે. પટેલ, કુલપતિશ્રી, સ.દાં.કૃ.યુ., સ.કૃ.નગરે પ્રથમ ખેડૂતોનો ખાસ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે કોવીડ-૧૯ મહામારીની ખુબ જ વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ ખેડૂતોએ દેશની જનતાને અનાજ અને શાકભાજી પુરા પાડ્યા છે તે અભિનંદનને પાત્ર છે. વધુમાં તેઓએ ખેડૂતોને સલાહ આપી કે આપના ફળો- શાકભાજીનું એક્ષ્પોર્ટ થાય તો જ વધુ આવક મળે. પરંતુ

ખેડૂતો રાસાયણિક દવાઓનો આડેધડ ઉપયોગ કરતા હોઈ ઉત્પાદનમાં જંતુનાશકોના અવશેષો વધુ પ્રમાણમાં જોવા મળતા હોઈ પરદેશમાં આપણા ફળો અને શાકભાજી નિકાસ કરી શકાતા નથી. તો જંતુનાશકોના વપરાશમાં ખેડૂતોએ ખાસ સંયમ રાખવા ઉપર ભાર મુક્યો. વધુમાં તેઓએ રણતીડનો પ્રશ્ન દેશમાં અને રાજ્યમાં આગળ વધી રહ્યો છે તેના માર્ગદર્શન માટે ખાસ વ્યાખ્યાન રાખ્યું છે તે આવકારદાયક જણાવી ખેડૂતો આજના વેબિનારમાં વૈજ્ઞાનિકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવશે તેનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડે તેવી વિનંતી કરી.

આ વેબિનારમાં ડૉ. પી. એસ. પટેલ અને ડૉ. એલ. વી. ઘેટિયાએ અનુક્રમે ખરીફ અને શાકભાજી પાકોમાં આવતી મુખ્ય જીવાતો અને તેના નિયંત્રણ વિશે જણાવેલ. ડૉ. એલ. એફ. અકબરીએ ખરીફ પાકોના વિવિધ રોગોના નિયંત્રણ વિશે વિસ્તૃત ચર્ચા કરેલ. ડૉ. બી. ડી. પટેલે નીંદણ નિયંત્રણ ઉપર અને ડૉ. કે. ડી. પરમારે ખેતી પાકોના જંતુનાશકોના અવશેષો અંગે માર્ગદર્શન આપેલ જ્યારે ડૉ. જી.એમ. પટેલે રણતીડની જુદી જુદી વ્યવસ્થાપન પદ્ધતિઓ ઉપર ખુબ જ વિસ્તૃત વ્યાખ્યાન આપેલ. આ વેબિનારનું સમગ્ર સંચાલન ડૉ. એન.એમ.ગોહેલ અને ડૉ.એન. બી .પટેલ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું. અંતમાં આભારવિધિ ડૉ. બી.એચ.પટેલ, મહામંત્રી, પીપીએજી દ્વારા કરવામાં આવેલ અને વેબિનાર પૂર્ણ જાહેર કરેલ.



Zoom Meeting

Recording... **LIVE** on Custom Live Streaming Service

Participants (8)

Q. Find a participant

- Anand Agricultura... (Host, me)
- DV Dr.R.V.Vyas, Vice Chancellor AAU,...
- DG DR. GHETIYA NAU NAVSARI
- DP Dr. PRAKASH
- LF L F Akbari (JAU)
- PT PS to Vice Chancellor, AAU, Anand
- V VC,SDAU
- GA Galaxy A5 (2016)

Invite Mute All